



Long-Term Care Home Update

Community Newsletter



ફેબ્રુઆરી 2022

લાંબાગાળાની સંભાળનાં ઘરનું નામ ઔપચારિકપણે જાહેર કરતાં

Ajax Pickering Hospitalની બાજુમાં આવેલ નવા લાંબાગાળાની સંભાળનાં ઘરનું નામ 'Lakeridge Gardens' તરીકે ઔપચારિકપણે જાહેર કરતા Lakeridge Health અત્યંત ઉત્સાહી અને ઉત્સુક છે.

પાછલા વર્ષે, Lakeridge Healthએ Durham Regionનાં નિવાસીઓને આ નવા અત્યાધુનિક લાંબાગાળાની સંભાળનાં ઘરનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા નામ માટે તેમની પાસેથી માહિતી અને કલ્પનાઓ વિશે જણાવવા કહ્યું હતું. સમગ્ર Durham Regionમાંથી 600થી પણ વધુ જવાબો મેળવવાની સાથે જે નવા ઘર માટે અતિશય પ્રમાણમાં સમર્થન અને રુચિ જોવા મળી એ બાબતને લઈને Lakeridge Health આનંદની લાગણી દર્શાવે છે.

Lakeridge Gardens નામ Durham Regionનાં અનેક મંતવ્યોનું તેમજ એવા પ્રત્યેક વ્યક્તિનું શાનદારપણે પ્રતિનિધિત્વ કરે છે જેમણે આ નામકરણની પ્રક્રિયા માટે પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો છે. Lakeridge Gardens એક સમૃદ્ધ ક્ષેત્ર હોવાથી તેનાં પ્રાકૃતિક દૃશ્યને પણ સમાવિષ્ટ કરે છે. Growth for Lakeridge Health નિવાસીઓ અને તેમનાં પરિવારો માટે એક એવું સંગઠન છે જેઓ આ લાંબાગાળાની સંભાળની સવલતને તેમનાં ઘર તરીકે સંબોધશે.

Premier Ford Lakeridge Gardensની મુલાકાત લીધી

1લી ફેબ્રુઆરીએ, મંગળવારે, નવા ઘરનાં આગામી અનાવરણ પ્રસંગને ઉજવવા માટે ઑન્ટેરિયોનાં Premier Doug Ford, મંત્રીઓ Paul Calandra, Christine Elliott, Kinga Surma, તેમજ Peter Bethlenfalvyની સાથે Lakeridge Gardensની મુલાકાત લીધી હતી.

2020માં જાહેર કર્યા મુજબ, Lakeridge Gardens એ એક એવું પ્રથમ લાંબાગાળાની સંભાળનું ઘર છે જે Ontario's Accelerated Build Pilot Program અન્વયે વિકસી રહ્યું છે. એ હકીકત કે ઘરનું નિર્માણ સમયસર અને આયોજન પ્રમાણે થશે તે Lakeridge Health, Infrastructure Ontario, અને PCL Construction દરમિયાન સહયોગ સાધવા બાબત એક સ્પષ્ટ દૃઢશક્તિનો પુરાવો છે.

ઘર વિશે Premier Fordએ કહ્યું કે, "માત્ર 13 મહિનામાં જ અમારી સરકારનાં Accelerated Build Pilot કાર્યક્રમ અન્વયે Ajax Pickering Hospital સ્થિત પ્રથમ નવા લાંબાગાળાની સંભાળનાં ઘરને જોઈને હું અત્યંત પ્રસન્ન થયો છું. અમારા સૌથી વધુ વિશિષ્ટ સંભાળની જરૂરિયાતવાળા નિવાસીઓ માટે વધુ લાંબાગાળાની સંભાળ માટેનાં બેઝસની તાતી જરૂર છે એવી માંગણી અમે ધ્યાન પર લીધી અને તેથી Team Ontario આ વચન પૂર્ણ કરી રહી છે."



1 ફેબ્રુઆરી, 2022નાં દિવસે Premier Ford Lakeridge Gardensની બહાર મીડિયા સાથે વાત કરી હતી (સ્ત્રોત: Twitter @fordnation)

Sharon Cochran, અધ્યક્ષા, ટ્રસ્ટી મંડળે, મીડિયા કાર્યક્રમ દરમિયાન મહેમાનોને આચ્કાયાં હતા

Lakeridge Gardens સ્થિત કર્મચારીવર્ગ પૂરો પાડવો

હવે જ્યારે મુખ્ય બાંધકામ લગભગ પૂરું થવા આવ્યું છે ત્યારે મુખ્ય પ્રવૃત્તિને સાંભળ લેવાનું આયોજન અને સંચાલનની દિશા તરફ બદલવામાં આવી છે. એકવાર સંપૂર્ણપણે કાર્યરત થઈ જાય એટલે 504 સમર્પિત સ્વાસ્થ્ય સંભાળ અને વહીવટી કર્મચારીવર્ગ Lakeridge Gardens સ્થિત કામ કરશે.

Lakeridge Health એવા કર્મચારીવર્ગને એકત્રિત કરવામાં અતિ વ્યસ્ત હતી કે જે ઉચ્ચ ગુણવત્તાવાળી નિવાસી સંભાળ લેવા કાળે સમર્પિત હોય. આજની તારીખ સુધી, Lakeridge Healthએ 164 વ્યક્તિગત સહાયક કાર્યકરો, 47 પ્રમાણિત વ્યવહારુ નર્સો અને 29 પ્રમાણિત નર્સોને કામ પર રાખેલી છે.

Lakeridge Gardensની અંદર એક ઝલક



પરિવારો માટે એકત્રિત થવા અને તેમના પ્રિયજનો સાથે મુલાકાત ગોઠવવાનું એક સ્થળ



સમગ્ર Lakeridge Gardensમાં આવેલા નિવાસીઓ માટે વસવાટ કરવાનાં 20 ક્ષેત્રો પૈકીનું એક ક્ષેત્ર



સારવાર કરાવવા માટે બેડ, ખાનગી અથવા અર્ધ-ખાનગી બાયડમ, તેમજ એક મોટી બારી સાથે પૂર્ણ કરાયેલો એક નિવાસી ઓરડો



બંધ અગાથીઓ ઉપરાંત, નિવાસી ફ્લોર્સ મોટા બાલ્કનીનો પણ સમાવેશ કરે છે જેથી નિવાસીઓ હુંડાળા વાતાવરણને માણી શકે

એ બાબતેની ખાતરી રાખો કે સંપર્કમાં રહી શકો

એકદમ નજીકનાં ભવિષ્યમાં Lakeridge Gardensનો પ્રારંભ થવાથી, આવનારા મહિનાઓમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી જોવા મળશે. એ બાબત મહત્વપૂર્ણ છે કે અમે તમારી પાસેથી આદાન-પ્રદાન કરવાનું ચાલુ રાખીએ.

જો તમારે કોઈ પ્રશ્નો હોય અથવા તો Lakeridge Gardens વિશે વધુ માહિતી ઈચ્છતા હો, તો કૃપા કરીને 905-576-8711 એક્સ્ટેન્શન 34167 પર કોલ કરો અથવા AjxLTC@lh.ca પર ઈમેઈલ કરો. ચાલી રહેલી છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે તમે અમારી વેબસાઈટ www.lh.caની પણ કોઈ પણ સમયે મુલાકાત લઈ શકો છો.